

પત્રક ભાગ-૧

કાર્યવાહીની ટૂંકી નોંધ

ચોદમી ગુજરાત વિધાનસભા

છકું સત્ર

શુક્રવાર, તા. ૨૮મી ફેબ્રુઆરી, ૨૦૨૦

માનનીય અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી અધ્યક્ષસ્થાને

સભાગૃહ સવારના ૧૦.૦૦ વાગ્યે મળ્યું.

૧. તારાંકિત પ્રશ્નોત્તરી

શુક્રવાર, તા. ૨૮મી ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજની તારાંકિત પ્રશ્નોત્તરીની યાદીમાંના પ્રશ્નો અગ્રતાક્રમ- ૧, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨ના મૌખિક જવાબ આપવામાં આવ્યા.

ગેરહાજર રહેલ સભ્યશ્રીનો પ્રશ્ન અગ્રતાક્રમ-૨ને અતારાંકિત ગણવામાં આવ્યો.

સમયના અભાવે ન પૂછાયેલા પ્રશ્નો અગ્રતાક્રમ-૧૩થી ૩૧૧ને પણ અતારાંકિત ગણવામાં આવ્યા.

પ્રશ્નોત્તરીનો સમય સવારના ૧૧.૦૦ વાગ્યે પૂરો થયો.

૨. માનનીય અધ્યક્ષશ્રીની જાહેરાત

માનનીય અધ્યક્ષશ્રીએ લોકસભાના માનનીય અધ્યક્ષશ્રી ઓમ બિરલાએ કરેલ સૂચન અનુસાર વર્ષ ૨૦૧૯થી ગુજરાત રાજ્યની વિધાનસભામાં શ્રેષ્ઠ ધારાસભ્યશ્રીનો એવોર્ડ આપવાની જાહેરાત કરી.

૩. માનનીય મંત્રીશ્રીની સ્પષ્ટતા

માનનીય શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાની ટેબ્લેટની ખરીદી અંગે સ્પષ્ટતા

માનનીય વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ તા.૨૭-૦૨-૨૦૨૦ને ગુરુવારના રોજની પ્રશ્નોત્તરી દરમિયાન સરકારે ખરીદેલ ટેબ્લેટની મૂળ કિંમત ખૂબ જ ઓછી છે તેમ છતાં સરકારે તેને ખૂબ જ ઉંચા ભાવે ખરીદી કર્યા અંગેની રજૂઆત કરતાં, માનનીય શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ આ બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરી વિગતવાર અહેવાલ સભાગૃહ સમક્ષ રજૂ કરી, માનનીય વિરોધપક્ષના નેતાશ્રીએ કરેલ આક્ષેપ સદંતર પાયાવિહોણો હોવાની રજૂઆત કરી, માનનીય વિરોધપક્ષના નેતાશ્રીએ આ બાબતે માફી માગવી જોઈએ અથવા તો તેમણે કરેલ આક્ષેપ પાછો ખેંચવો જોઈએ તેમ જણાવ્યું. ત્યારબાદ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આ બાબતમાં પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં, માનનીય વિરોધપક્ષના નેતાશ્રીએ આ બાબતે જરૂરી તપાસ કરવા સમય આપવાની માંગણી કરતાં, માનનીય અધ્યક્ષશ્રીએ તેમને તપાસ કરવા સમય આપવો જરૂરી છે તેમ જણાવ્યું.

૪. પોઈન્ટ ઓફ ઓર્ડર

માનનીય મંત્રીશ્રીઓના પ્રશ્નોત્તરી દરમિયાનના જવાબો ટૂંકા આપવા બાબત.

માનનીય સભ્યશ્રી પુંજાભાઈ વંશે પ્રશ્નોત્તરી દરમિયાન માનનીય મંત્રીશ્રીઓ સભ્યશ્રીઓના પ્રશ્નો સાથે સુસંગત ન હોય તેવા લંબાણપૂર્વકના જવાબો આપી વધુ પ્રશ્નો પૂછવાનો અવકાશ રહેતો ન હોવા અંગેના પૂર્વ માનનીય અધ્યક્ષશ્રીઓના નિર્ણયો હોવાનું જણાવી, માનનીય મંત્રીશ્રીઓને ટૂંકમાં જવાબ આપવા અંગે જણાવવા માનનીય અધ્યક્ષશ્રીને ર્લીંગ આપવાનું જણાવતાં, માનનીય અધ્યક્ષશ્રીએ હમણાંથી મેં આ બાબત અમલમાં મૂકી દીધેલ હોવાથી અલગ ર્લીંગની આવશ્યકતા ન હોવાનું જણાવી, માનનીય મંત્રીશ્રીઓને સભ્યશ્રીઓના પ્રશ્નોના ટૂંકમાં જવાબો આપવા જણાવ્યું.

૫. રાજ્યપાલશ્રીના સંબોધન માટેના આભાર પ્રસ્તાવ પર ચર્ચા (ત્રીજો અને છેલ્લો દિવસ)

માનનીય અધ્યક્ષશ્રીએ, સભ્યશ્રી પિયુષભાઈ દેસાઈએ, સભ્યશ્રી કુબેરભાઈ ડીંડોરના અનુમોદનથી તા.૧૦મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ રજૂ કરેલ નીચે મુજબનો પ્રસ્તાવ સભાગૃહ સમક્ષ વાંચી સંભળાવ્યો. રાજ્યપાલશ્રીને નીચે મુજબનો સંદેશો પાઠવવો.

“અમો, આ સત્રમાં એકત્ર થયેલા ગુજરાત વિધાનસભાના સભ્યો, રાજ્યપાલશ્રીએ આ સભાગૃહ સમક્ષ કરેલ સંબોધન બદલ તેમનો આભાર માનીએ છીએ.”

ત્યારબાદ આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં નીચેના સભ્યશ્રીઓએ ભાગ લીધો.

(૧) શ્રી દુષ્યંતભાઈ પટેલ

(૪) શ્રી બળદેવજી ઠાકોર

(૨) શ્રી અમિત ચાવડા

(૫) શ્રી જીગ્નેશકુમાર મેવાણી

(૩) શ્રી સુરેશભાઈ ઘ.પટેલ

(વિરામ બપોરના ૧૨.૦૦થી ૧૨.૩૦)

વિરામ બાદ નીચેના વધુ સભ્યશ્રીઓએ ચર્ચામાં ભાગ લીધો.

- | | |
|-------------------------------|----------------------------|
| (૬) શ્રી શૈલેષભાઈ મહેતા | (૧૩) શ્રી પુનમભાઈ પરમાર |
| (૭) શ્રી ગ્યાસુદ્દીન શેખ | (૧૪) શ્રી અભેસિંહ તડવી |
| (૮) ડો.નીમાબેન આચાર્ય | (૧૫) શ્રી ગુલાબસિંહ રાજપૂત |
| (૯) શ્રી પ્રેમસિંહભાઈ વસાવા | (૧૬) શ્રી ભીખાભાઈ જોષી |
| (૧૦) શ્રી બાબુભાઈ પટેલ | (૧૭) શ્રીમતી ગેનીબેન ઠાકોર |
| (૧૧) શ્રી અમરીષભાઈ ડેર | (૧૮) ડો.આશાબેન પટેલ |
| (૧૨) શ્રી જેઠાભાઈ આહિર(ભરવાડ) | (૧૯) શ્રી રઘુભાઈ દેસાઈ |

આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આપતા હતા ત્યારે સભાગૃહનો સમય પૂર્ણ થવા આવતાં, માનનીય અધ્યક્ષશ્રીએ માનનીય મુખ્યમંત્રીશ્રીનું પ્રવચન પૂરું થાય અને માનનીય રાજ્યપાલશ્રીના સંબોધન માટેના આભાર પ્રસ્તાવ પરનું મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી સભાગૃહનો સમય લંબાવવાની જાહેરાત કરી.

ત્યારબાદ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પોતાનું અધૂરું રહેલ પ્રવચન પૂર્ણ કર્યું.

ત્યારબાદ સભ્યશ્રી પિયુષભાઈ દેસાઈએ ચર્ચાનો જવાબ આપવા બદલ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો તથા ચર્ચામાં ભાગ લેનાર તમામ સભ્યશ્રીઓનો આભાર માન્યો.

ત્યારબાદ માનનીય રાજ્યપાલશ્રીના સંબોધન માટેના આભાર પ્રસ્તાવ પરના રજૂ થયેલ સુધારા ક્રમાંક- ૧, ૪, ૫, ૬, ૯, ૧૦, ૧૧, ૧૩, ૧૫, ૧૮, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૯, ૩૩, ૩૪ અને ૩૫ મત માટે મૂકવામાં આવ્યા અને નામંજૂર કરવામાં આવ્યા.

ત્યારબાદ રાજ્યપાલશ્રીના સંબોધન માટેનો આભાર પ્રસ્તાવ મત માટે મૂકવામાં આવ્યો અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો.

**સભાગૃહ, સોમવાર, તા.૨૭ માર્ચ ૨૦૨૦ના રોજ બપોરના ૧૨.૦૦ વાગ્યે
ફરી મળવા માટે બપોરના ૨.૩૯ વાગ્યે મુલતવી રહ્યું.**

ગુજરાત વિધાનસભા સચિવાલય,
ગાંધીનગર.
તા. ૨૮મી ફેબ્રુઆરી, ૨૦૨૦

ડી.એમ.પટેલ
સચિવ,
ગુજરાત વિધાનસભા.